

# સરગવો

## અનેક રોગમાં અકસીર



□ પૈધ રાજલ શ્રીકૃષ્ણ

અંગેજુમાં Horse Radish tree તરીકે ઓળખાતાં સરગવાના જડને બધા જ છે. આના શીંગ અને ફૂલો શાક તરીકે, કદીમાં નાભવા માટે ખૂબ જ અસ્વીકાર છે. મૌઝી શીંગોવણું જડ મીઠો સરગવો અને કડવી શીંગોવણું જડ કડવા સરગવાના નામે જોણાય છે. કુમાર પાણની મીઠા સરગવાની ભાજ થાપ છે જેમાં વિટામીન-એ ખૂબ સારા ગ્રમાણાં હોય છે. સુંદર પુષ્પોને લઈને શોભા પ્રગટ કરનાર હોવાથી શોભાંજન પણ કહેવાય છે.

સરગવાનાં પંદડા તથા શીંગુમાં ડેરોટીન અને એસ્ટોબોકી એસિડ ખૂબ જ હોય છે.

મૂળ ધાલમાં બે આલકલોઇડ છે (૧) મોરિનીન (૨) મોરિનીનિન. મોરિનીનિનની અસર મધ્યવર્તી નાડી તરંગ પર ખૂબ જ સ્પષ્ટ છે. હદ્યના ઘંભરા વધે છે, કંસસના સંકોચાય છે તથા બ્લડપ્રેશન વધે છે.

મૂળમાં એન્ટિબાયોટિક તત્વ ટેરિગોસ્પર્મિન (Pterygospermin) છે અને તે ધારું ગ્રામ પોઝિટિવ (gram positive) અને માલાગોલાયુઝન્ય (staphylococcal adn streptococcal) ઉપસર્ગોનાં લાભાદ્યક છે. તે અધિકાંદ્રીય ડોષાંનો પ્રાર્થનાદ કરે છે તથા તેમાં વેદનાહરરણનો ગુણ પણ છે. વાતનાદીઓ પર અવસાહક પ્રાબાલ પડે છે જેમાંથી ગર્ભાશયના અનિયમિત સંકોચાય શરૂ થઈ તેને બધા મળે છે. ટેરિગોસ્પર્મિન અનેક પ્રકારની ફૂળની વૃક્ષિકને પણ રોકે છે.

પાણનાં રસમાં જલદ એન્ટિબાયોટિક કાર્બાક્ટિન પૂર્વવાર થયેલી છે. *micrococcus pyrogenes* var *qureus* *Escherichia coli* અને *Bacillus subtilis* આ જીવાદ્યુદ્ધો ઉપર ખાસ જંતુન અસર છે.

### સરગવાનું રોગો પરતવનું કાર્મિકત્વ

હેડકો અને શાસમાં સરગવાના પાણનો કવાય પીવાથી રાહત જાણાય છે તથા કદ્દી છાની ભરાઈ હોય તેવું લાગે ત્યારે સરગવાના મૂળનો ઊડાળો અડવો જ્વાસ જેટલો ડિવસમાં બે વાતાં પીવાથી તડાળ રાહતનો અનુભવ થાય છે. ઉડાળામાં હિંગ ઉમેરવાથી પણ સુંદર પરિણામ મળે છે. શરીરમાં સરગવાના મૂળની ધાલનો કવાય લગદર નાખીને પીવાથી રાહત થાય છે. શરીરને લાંબે માણું દુઃખાનું હોય તો બીજા પાણીમાં વર્સિને નાકના નસ્તકોરણાં બે-બે ટીપાં પાડવાથી (નસ્ય લેવાથી) દુઃખાચો દૂર થાય છે.

- ગુમાને પહવા માટે સરગવાની ધાલને પાણીમાં વર્સિને, સહેજ ગરમ કરી ચોપડાનું આ ઉપરાંત સોજા પર સરગવાનો ગુંદર પણ ચોપડવામાં આવે છે. • બીજમાંથી નીકળાનું તેથી ગરમ અને ઉતેજક હોવાથી સંવિચા અને બીજા વાયુજુન્ય રેનાયુક્લ રોગોમાં લગાવવાથી રાહત અનુભવાય છે. સાંઘાના સોજા તથા શરીરના કોઈ પણ એક ભાગમાં થતાં દુઃખાચાં ધાલનો ગરમ લેપ ચોપડી જ વાર માટે કરવાથી રાહત થાય છે.

- મોકાની જ્કાફાટ, મોકાનો લક્વા (અર્દીત), પણાથાત વગેરે નાડી સંસચનના રોગોમાં મૂળનો સ્વરસ અને પાણનો સ્વરસ વૈઘ્નીય સલાહ અનુસાર, રોગીની ગંભીરતાને ધ્યાનમાં લઈને લેવો હિતાવદ છે.

- દાંતમાં દુઃખાચો થતો હોય તો છાલાનું ચૂર્ણ જરાના ચૂર્ણ સાથે પેંડા પર લગાવવાથી રાહત થાય છે. કુમિકંતમાં કવાયના કોગળા કરવાથી સારા પરિણામો મળ્યા છે. યુરિક એસિડ વધારે હોય તેવા દાદિની પણના અંગ્રૂદા પર સોજો આવતો હોય છે અને ખૂબ જ દુઃખાચો થાય છે એવા સમયે વાયવરણના મૂળની ધાલ અને સરગવો વાદીને લગાવવાથી રાહત થાય છે. • હુસસલાના દર્દની પાણના ઊડાળામાં બેસાડવાથી સોજો ઓછો થતાં વેદનામાં રાહત જાણાય છે.